

Seat No. : _____

NC-113

November-2013

B.Sc. Sem.-III (CBCS Semester System)

CC-202 – Physics

Time : 3 Hours

[Max. Marks : 70]

સ્વીચ્છા : (1) દરેક પ્રશ્નના ગુણ સરખા છે.

Instructions : All questions carry equal marks.

(2) સંજ્ઞાઓના અર્� પ્રાણીલીકા મુજબ છે.

Symbols have their usual meanings.

(3) પ્રશ્નની જમણી બાજુના અંક પ્રશ્નોના ગુણ દર્શાવે છે.

Numbers on right side of questions indicate marks.

1. (a) ફોરિયર શ્રેષ્ઠી લખો અને સમજાવો. લંબ ગુણધર્મનો ઉપયોગ કરી તેમાં આવતાં અચળાંકો a_n અને b_n ના મૂલ્યો શોધો. 7

Write and explain Fourier series. Obtain the values of constants a_n & b_n using its orthogonal properties.

અથવા/OR

ફોરિયર શ્રેષ્ઠીનું સંકર સ્વરૂપ તારવો. તેમાં આવતા અચળાંકો માટેના સૂત્રો મેળવો.

Obtain Fourier Series in its complex form. Deduce expressions for the constants occurring in it.

(b) કર્વીલીનીયર યામ પદ્ધતિમાં \vec{ds} અને ds^2 મેળવો. 7

Obtain expressions for \vec{ds} & ds^2 in curvilinear co-ordinate system.

અથવા/OR

લંબ યામ પદ્ધતિ કેવી રીતે તૈયાર કરાય, તે જણાવી નળાકારીય યામ પદ્ધતિની રૂચના ચર્ચો અને \vec{ds} અને ds^2 ના સૂત્રો મેળવો.

Explain how an orthogonal co-ordinate system can be constructed. From this information discuss the construction of cylindrical co-ordinate system and obtain expression for \vec{ds} & ds^2 in that system.

2. (a) મુક્ત પતન કરતાં પદાર્થ પર કોરીયોલીસ બળની અસર જરૂરી સમીકરણ સાથે ચર્ચો. 7

Discuss the effect of coriolis force, on a freely falling particle, with necessary equations.

અથવા/OR

કેન્દ્રિક બળના ડિસ્સામાં જો બળ સંરક્ષી હોય તો ધાર્ત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે તેમ સાબિત કરો.

Prove that in case of central force, if the force is conservative then mechanical energy is conserved.

- (b) રૂથરફોર્ડ પ્રક્રીણન જરૂરી સૂત્ર સાથે ચર્ચો. 7

Discuss Rutherford scattering with necessary equations.

અથવા/OR

પરિભ્રમણ કરતી ધામ પદ્ધતિમાં કણના વેગ માટેનું સૂત્ર મેળવો.

Derive an expression for the velocity of a particle in the rotating co-ordinate system.

3. (a) કણ અને દ્રવ્ય વચ્ચેની આંતરકિયા ચર્ચો અને “ગેઈગરનો નિયમ” મેળવો. 7

Discuss the interaction between particles and matter and obtain “Geiger rule”.

અથવા/OR

β -કિરણ સ્પેક્ટ્રોમીટરની રચના અને કાર્યપદ્ધતિ સમજાવો. β -કિરણની સાપેક્ષ ગતિઉર્જ માપવા માટેનું સૂત્ર મેળવો.

Explain the construction and working of a β -Ray Spectrometer. Drive expression to measure the relativistic kinetic energy of the β -Ray.

- (b) ન્યુક્લિયર મેળેન્ટિક રેઝોનન્સનો પ્રયોગ અને તેના ઉપયોગો વર્ણવો. 7

Describe an experiment to study NMR and its applications.

અથવા/OR

નીચેના પર નોંધ લખો :

Write a note on :

- (1) બબ્લ ચેમ્બર

Bubble chamber

- (2) સ્પાર્ક ચેમ્બર

Spark chamber

4. (a) બાયોટ-સાવર્ટનો નિયમ સમજાવો. દર્શાવો કે વિદ્યુતપ્રવાહો ધારિત બે બંધ લૂપ વચ્ચે લાગતું બળ
 $\vec{F}_1 = -\vec{F}_2$ છે. 7

Explain Biot-Savart law. Show $\vec{F}_1 = -\vec{F}_2$ force between two current carrying closed circuits.

અથવા/OR

ડાયામેનેટિક અને પેરામેનેટિક પદાર્થો પર ટૂકનોંધ લખો.

Write a note on, Diamagnetic & Paramagnetic substances.

- (b) બંધિત વિદ્યુતભારની પૃષ્ઠઘનતા (σ_b) અને કદ ઘનતા (ρ_b) પર નોંધ લખો. 7

Write a note on surface charge density (σ_b) and volume density (ρ_b) of bounded charge.

અથવા/OR

ડાઈ-ઇલેક્ટ્રિક માધ્યમમાં ગોસનો નિયમ મેળવો અને વિદ્યુત સસેપ્ટેબીલીટી તથા પરમીટીવીટીની સમજૂતી આપી $\vec{D} = \epsilon \vec{E}$ મેળવો.

Obtain Gauss-law for dielectric medium and explain electric susceptibility and permittivity and obtain $\vec{D} = \epsilon \vec{E}$.

5. ટૂકમાં જવાબ આપો : (પ્રત્યેક પ્રશ્ન 1 ગુણનો છે.) 14

Answer in short [each question is of 1 marks.]

- (1) પર્સેવાલનું સૂત્ર લખો.

Write an equation of Parseval's.

- (2) તરંગ પેકેટ માટે સમૂહ વેગનું સૂત્ર લખો.

Write an equation of group velocity for wave-packet.

- (3) કેપ્લરનો બીજો નિયમ લખો.

Write Kepler's Second Law.

- (4) પ્રકીર્ણનની વ્યાખ્યા આપો.

Define Scattering.

- (5) સ્થિતિસ્થાપક પ્રકીર્ણનની વ્યાખ્યા આપો.

Define Elastic Scattering.

- (6) અસ્થિતિસ્થાપક પ્રકીર્ણનની વ્યાખ્યા આપો.

Define Inelastic Scattering.

- (7) કેપ્લરનો પ્રથમ નિયમ લખો.

Write Kepler's First Law.

(8) કોમ્પટન અસરની વ્યાખ્યા આપો.

Define Compton effect.

(9) પ્રપોર્શનલ કાઉન્ટર ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

On which principle proportional counter is working ?

(10) લાર્મોર આવૃત્તિની વ્યાખ્યા આપો.

Define Larmor frequency.

(11) સિન્કોન્સ-કણાની વ્યાખ્યા આપો.

Define Synchronous particle.

(12) ધ્રુવીકરણાની વ્યાખ્યા આપો.

Define Polarization.

(13) ફોટો-ઇલેક્ટ્રિક અસરની વ્યાખ્યા આપો.

Define Photo-electric effect.

(14) લોરેન્ટ્ઝ બળની વ્યાખ્યા આપો.

Define Lorentz force.
